



વેપારીઓ તેમજ દુકાનમાં કામ કરતી વ્યક્તિ માટે ના સુચનો

1. ફરજિયાત માસ્ક પહેરવો
2. સોશિયલ ડિસ્ટન્સ (દુકાનદાર થી ઓછા માં ઓછું છ ફૂટ નું અંતર બનાવો)
3. બિનજરૂરી કોઈ પણ વસ્તુ ને સ્પર્શ ન કરવું.
4. વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા કે સેનિટાઇઝરનો ઉપયોગ કરવો.
5. એપોઇન્ટમેન્ટ થી અથવા ટોકન દ્વારા સમય આપી ભીડ ઓછી કરવા આગ્રહ રાખવો.
6. ગ્રાહકોને તમામ માલ સામાન માટે ગ્રાહક દ્વારા લાવાયેલ થેલીમાં જ આપવો
7. પેટીએમ, ભીમ એપ, ગુગલ પ્લે કે બેંક એપ થી ચુકવણી કરવાનો આગ્રહ રાખો. જો એ શક્ય ન હોય તો
 - 7.1 ગ્રાહકો પાસેથી મળતા રૂપિયા-સિક્કા એક અલગ બોક્સ કે ઢાંકણા વાળા ડબ્બામાં ગ્રાહક દ્વારા સીધા જ નખાવવા. વેપારીઓએ આ રૂપિયા-સિક્કા અડવા જ નહીં.
 - 7.2 આજે મળેલ રૂપિયા-સિક્કા બીજા દિવસ સુધી એમજ મુકી રાખવા અને ત્રીજા દિવસે જ વપરાશમાં લેવા. જો એમ શક્ય ન હોય તો કાગળ ના ચલણને ઇસ્ત્રીની મદદથી જીવાણુ મુક્ત કરો. નોટ ને બંને બાજુ ઇસ્ત્રી કરવી. ચલણના જીવાણુ મુક્ત ક્રિયા પછી તમારા હાથને સાબુ અને પાણીથી ધોવા.
8. માસ્ક પહેરેલ ગ્રાહક ને જ દુકાન માં પ્રવેશ આપવો. પહેલા એમનું નામ અને મોબાઇલ નંબર એક નોટ- બુક કે ડાયરી માં એમની પાસે નોંધાવવું અને પછી તેઓના હાથ સેનિટાઇઝર દ્વારા સ્વચ્છ કરાવવ્યા બાદ જ દુકાનમાં પ્રવેશ આપવો.
9. પલ્સ ઓક્સિમીટર વડે કર્મચારીઓ ના ઓક્સિજન લેવલની નિયમિત ચકાસણી કરવી અને જો રીડીંગ 95% થી ઓછું આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર સંપર્ક કરવો અથવા 104 પર જાણ કરવી.
10. કર્મચારીઓ ને કોરોના સંક્રમણથી બચવા માટે નિયમિત ગરમ પાણીના કોગળા કરાવવા.
11. કર્મચારીઓ ને નિયમિત ગરમ પીણાં જેવાકે, ચા, કોફી તેમજ ઉકાળાનું સેવન કરાવવું અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન C, B કોમ્પ્લેક્સ તેમજ ઝીંકની ગોળીઓ નું ડોક્ટરની સલાહ મુજબ સેવન કરાવવું.
12. કર્મચારીઓ ને હોમીયોપેથીક દવા આર્સેનિક આલ્બમ અને આયુર્વેદિક દવા સંશમની વટીનું સેવન કરવા સલાહ આપવી.